



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી), વર્ગ-૨ (જા.ક.૩૮/૨૦૧૭-૧૮) ની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફીસર ગ્રેડ-૨ ની જગ્યા માટે પણ અરજી કરેલ હોય અને આ બંને જગ્યાઓ માટેની લેખિત કસોટી તા.૧૫-૧૦-૨૦૧૭ ના રોજ લેવામાં આવનાર હોઈ આવા ઉમેદવારો બંને પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે તે માટે આયોગે જા.ક.૩૮/૨૦૧૭-૧૮ માટેની કસોટીના સમયમાં ફેરફાર કરેલ છે અને તે અંગેની જાણ વર્તમાનપત્રો તેમજ આયોગની વેબસાઇટના માધ્યમથી કરેલ છે. ઉક્ત અગત્યની જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ આયોગની તા.૨૮/૦૯/૨૦૧૭ ની અગત્યની જાહેરાતમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે અને તા.૩૦/૦૯/૨૦૧૭ ના રોજ સાંજે ૬:૧૦ કલાક સુધી તેઓનું પરીક્ષા કેન્દ્ર બદલી આપવા માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારોને જ અમદાવાદ ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવાનો આયોગે નિર્ણય કરેલ છે. આ બાબતે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા અને તેનું ચુસ્તપણે અમલ કરવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે.

- (૧) આપે નવો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો રહેશે નહીં.
- (૨) ઉપરોક્ત દર્શાવવામાં આવેલ TEMPORARY NUMBER માત્ર આપની બેઠક વ્યવસ્થાના ભાગરૂપે જ છે.
- (૩) પરીક્ષા ખંડમાં પાસપોર્ટ સાઇઝના ૨ (બે) ફોટા તેમજ આઈ-ડી પ્રૂફ સાથે ઉપસ્થિત થવાનું રહેશે.
- (૪) આપને ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર અંગે આપને SMS, E-MAIL તથા SPEED POST મારફતે હવે પછી જાણ કરવામાં આવશે.
- (૫) OMR ANSWER SHEET માં આપે ડાઉનલોડ કરેલ પ્રવેશપત્રમાં દર્શાવેલ ROLL NUMBER (બેઠક નંબર) અને આપને આપવામાં આવે તે પ્રશ્નપત્રનો નંબર ENCODE કરવાનો રહેશે.
- (૬) પરીક્ષા કેન્દ્રના ફેરફાર સિવાયની અન્ય સૂચનાઓ અને જોગવાઈઓ આપે ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર અનુસાર યથાવત રહેશે.

નોંધ:

- (૧) જે ઉમેદવારોએ સૂચના મુજબના આધાર પુરાવા વિના અરજી કરેલ હશે તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
- (૨) ઉપરોક્ત વિગતેની બાબતો માત્ર અને માત્ર જે ઉમેદવારોએ એક જ દિવસે બે જુદી-જુદી ભરતી પરીક્ષાઓની બાબતે આધારો સાથે અરજી કરેલ હશે તેઓને માટે જ લાગુ પડે છે. તે સિવાયના અન્ય ઉમેદવારોને માટે રાખેતા મુજબની જ સૂચનાઓ લાગુ પડે છે. માત્ર જા.ક.૩૮/૨૦૧૭-૧૮ ની પ્રાથમિક કસોટીનો સમય તા.૧૫/૧૦/૨૦૧૭ ના રોજ ૧૪:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક છે.

તા.૦૧/૧૦/૨૦૧૭